



પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સંમતિ તેમજ ઘોષણા ફોર્મ

(નિશ્ચિત કરેલ નોંધણી સમય દરમિયાનમાં સભ્ય દ્વારા યોજનામાં દાખલ થતાં સમયે ભરવાનું ફોર્મ)

એજન્સી/બીસી (BC) કોડ :

બેંક બચત ખાતા નંબર :

યોજનામાં દાખલ થયાની તારીખ : ૧લી જુન/જુલાઈ/ઓગસ્ટ/સપ્ટેમ્બર, ૨૦૧૫

૧. પુરું નામ :	૫. મોબાઈલ/સંપર્ક નંબર :
૨. સરનામું :	૬. આધાર નંબર, જો હોય તો :
૩. જન્મ તારીખ (KYC-દસ્તાવેજ પુરાવા પ્રમાણે) (dd/mm/yyyy) <input type="text"/>	૭. કોઈ પણ પ્રકારની ખોડ-ખાંપણ (કિસેબિલીટી) થી પીડાવ છો ? હા/ના જો હા, તો તેની વિગતો જણાવો
૪. ઈ-મેઈલ આઈડી (e-mail)	૮. નોમિની (વારસદાર), જો હોય તો, તેનું નામ અને સરનામું, તેમજ તેમની સાથેનો સંબંધ
૯. જો નોમિની (વારસદાર) સગીર હોય, તો વાલી (Guardian) નું નામ અને સરનામું :	

હું “પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના” ના સભ્ય બનવા માટે સંમતિ આપું છું, જે ઉપર દર્શાવેલ બેંકની માસ્ટર પોલીસીના નં. **21220042150100000759** દ્વારા સંચાલિત કરવામાં આવશે.

હું આથી આપને મારા બચત ખાતામાંથી આજે રૂ. ૧૨/- (બાર રૂપિયા) + સર્વિસ ટેક્સ, જો લાગુ પડતો હોય તો, કપાત કરવાની અને તારીખ ૩૧ મે અથવા તે તારીખ પહેલાં દર વર્ષે બાર રૂપિયા અથવા સુધારેલ રકમ જે નક્કી થાય તે તરૂંત મને જાણ કરી, ફરીથી ફેરફાર અંગેની સૂચના સુધી કપાત કરવાની સત્તા આપું છું.

હું મારા મૃત્યુ બાદ મારા ઉપરોક્ત જણાવેલ નોમિની (વારસદાર) ને યોજના હેઠળ મળવાપાત્ર લાભો માટે નામાંકિત કરું છું. જો મારું મૃત્યુ, નોમિની (વારસદાર) ૧૮ વર્ષના થાય તે પહેલાં થાય તો, નોમિની (વારસદાર) ના ઉપર જણાવેલ વાલી (Guardian) ને યોજના નીચે મળવાપાત્ર લાભો માટે નામાંકિત કરું છું.

હું જાહેર કરું છું કે હું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના નીચે બીજા કોઈ બચત ખાતાથી સુરક્ષિત નથી, તેમ છતાં જો તેમ થયેલ જણાય તો ભરેલ પ્રીમિયમ રદ-બાદલ ગણાશે અને કોઈ પણ દાવાને પાત્ર રહેશે નહીં.

મારું વીમા કવચ નોંધણી તારીખના અનુગામી મહિનાની ૧લી તારીખથી મળશે જે મને મંજૂર છે.

હું માસ્ટર પોલિસી શરૂ થયા પછી પણ આ યોજનામાં જોડાવા માટે સંપૂર્ણ વાર્ષિક પ્રીમિયમ ચૂકવવા સંમત છું.

હું સંમત છું કે મે જ્યાં સુધી બધા જ પ્રીમિયમ ભર્યા હશે ત્યાં સુધી અને વાર્ષિક રીન્યુવલની તારીખે ૭૦ વર્ષની ઉંમર પ્રાપ્ત થાય ત્યાં સુધી હું આ યોજનાના સભ્યપદે તરીકે જોડાયેલ રહીશ.

હું આ યોજનાના તમામ નિયમો અને શરતોને બંધનકર્તા રહેવા માટે સંમત છું. જો મારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના પ્રવેશ અંગે જરૂરી એવી મારી અંગત વિગતો જરૂર જણાય તો, આપના દ્વારા **ધી ન્યુ ઈન્ડિયા એસ્યુરન્સ કં. લી.** ને પૂરી પાડવા માટે સંમતિ આપું છું.

હું આથી જાહેર કરું છું કે ઉપરોક્ત જણાવેલ વિગતો તમામ રીતે સાચી છે અને જે આ યોજનામાં પ્રવેશ માટેની આધારભૂત માહિતી રહેશે તેમજ જો કોઈ વિગતો ખોટી માલૂમ પડશે, તો ઉપરોક્ત યોજનામાં મારું સભ્યપદ રદ-બાતલ થયેલ ગણાશે, જે મને માન્ય છે.

તારીખ :

.....

સહીની ચકાસણી
(બેંક શાખાના અધિકારી)

ખાતેદારની સહી



રસીદ તેમજ વીમાનું સર્ટિફિકેટ



અમે આથી જાણ કરીએ છીએ કે શ્રી/શ્રીમતી.....કે જેનો બેંક બચત ખાતા નંબર અને આધાર નંબર (જો હોય તો)..... છે તેમજ **ધી ન્યુ ઈન્ડિયા એસ્યુરન્સ કં. લી.** (વીમા કંપનીનું નામ) અને માસ્ટર પોલિસી નંબર..... **21220042150100000759** દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાવા માટે કે જે તેમની જણાવેલ વિગતોની ખરાઈના આધારે મળવાપાત્ર રહેશે અને જણાવેલ બચત ખાતામાંથી આપોઆપ કપાત કરવાની સંમતિ અને મંજૂરી મળ્યાની પહોંચ આપીએ છીએ.

અધિકૃત બેંક અધિકારીની સહી અને સિક્કો